

ગેજિયા ક્રિકેટ/વોલીબોલ(શુટીંગ) ટુર્નામેન્ટ-2016-17

સ્પોન્સરશીપ માટે સરક્યુલર

તારીખ- 26.11.2016



આથી દરેક સભ્યોને જણાવતાં આનંદ થાય છે કે ગત વર્ષે આપણે ગેજિયા દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ની **Inter GEZIA Tournament** નું સફળતાપુર્વક આયોજન કર્યું હતું તેમાં આશરે 32 જેટલી ક્રિકેટ ટીમો અને આઠ જેટલી વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો તેથી ચાલુ વર્ષે પણ આપણે **Inter GEZIA Tournament** નું આયોજન કરવાનું નક્કી કરેલ છે તેમાં મોટા પ્રમાણમાં ભાગ લેવા વિનંતી છે, ધનાર ખર્ચને પહોંચી વળવા આપના સહકારની અપેક્ષા છે તો નીચે જણાવેલ યાદીમાંથી આપની અનુકૂળતા મુજબ સહકાર આપવા નમ્ર વિનંતી છે.

1. Every Principal Sponsor –Winner's Trophy -Cricket- and volleyball- Rs. 51,000/- (1)
2. Co-Sponsor – Runners-up Trophy Cricket- and volleyball- Rs. 31,000/- (1)
3. Breakfast Sponsor – Rs. 21,000/- (1)
- 4.General Sponsor – Rs. 11,000/- (1)
- 5..Banner Sponsor (Size-4x2.5 ft.) - Rs. 2,500/--(બેનર યુનિટે પોતે બનાવીને ગેજિયામાં આપવાનું રહેશે.)

ગેજિયા વતી,



સુધીરભાઈ વિચારે

(સેક્રેટરીશ્રી)

ગેજિયા ક્રિકેટ/વોલીબોલ (શુટીંગ)ટુર્નામેન્ટ-2016-17

સરક્યુલર

તારીખ- 26.11.2016




આથી ગેજિયાના મેમ્બરશ્રીઓને જાણાવવાનું કે ડીસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન ગેજિયા દ્વારા ક્રિકેટ અને વોલીબોલ(શુટીંગ) ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે,આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતાં યુનીટોએ બંને રમતો માટે પોતાના લેટરપેડ ઉપર 19 ખેલાડીઓની ટીમની યાદી સાથે બનાવી નીચે યુનીટના માલિક/ HRD મેનેજરશ્રી ના સહીસિક્કા સાથે તારીખ- ૧૦.૧૨.૨૦૧૬ સુધીમાં આપની અરજી ગેજિયામાં પહોંચાડવા વિનંતી છે ત્યારબાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ગેજિયા આયોજીત ક્રિકેટ/વોલીબોલ (શુટીંગ)ટુર્નામેન્ટ -૨૦૧૬-૧૭ ના નિયમો

- (1) આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટના યુનિટમાં નોકરી કરતા હોવા જોઈએ.દરેક ખેલાડીઓનુ ફોટો આઇડી અવશ્ય અરજી સાથે જોડવાનુ રહેશે..
- (2) ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે બંને રમતોમાં પ્રતિ ટીમ 2500/- રૂપિયા પ્રવેશફી રાખવામાં આવેલ છે જે નોન-રીફન્ડેબલ છે.
- (3) Sport shoes પહેરવા અનિવાર્ય છે. સફેદ જર્સી (White T shirt) ઇચ્છનીય છે.
- (4) એમ્પાયરનો નિર્ણય સૌને આખરી અને બંધનકર્તા રહેશે.
- (5) મેચના નિયત સમયે ગ્રાઉન્ડ ઉપર ટીમ સમયસર હાજર નહી થાય તો પંદર મિનીટ બાદ હાજર હરીફ ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
- (6) ભાગ લેનાર ટીમ માટે ગ્રાઉન્ડ ઉપર ચા/પાણી ની વ્યવસ્થા કરવામાં આવશે.
- (7) એક કરતાં વધારે યુનીટના કર્મચારી મળી ટીમ બનાવી શકશે ,પરંતુ કોઇ એક યુનીટની ટીમ તરીકે નોંધણી કરાવી શકાશે.
- (8) ફેક્ટરી માલિકોના કૌટુંબીક સભ્યો વધુમાં વધુ 3 (ત્રણ)ભાગ લઇ શકશે.
- (9) ઉપરોક્ત ટુર્નામેન્ટની કોઇપણ મેચનાં સમયપત્રકમાં ફેરફાર કરવાનો ગેજિયાનો હક અબાધિત રહેશે
- (10) દરેક ટીમમાં વધુમાં વધુ 19 સભ્યોનુ (ખેલાડીઓનુ) રજીસ્ટ્રેશન કરાવી શકાશે ,રજીસ્ટ્રેશન સમયે જે ખેલાડીનુ નામ આપવામાં આવેલ હશે તે ખેલાડી તે યુનિટ સિવાય ટુર્નામેન્ટની અન્ય યુનિટની ટીમમાંથી ફરીવાર રમી શકશે નહીં .
- (11) એક વ્યક્તિ વોલીબોલ અને ક્રિકેટ બંનેમાં રમી શકશે પરંતુ સમયપત્રક પ્રમાણે એકજ સમયે બંનેની રમત હશે તો તેમને જાતે વ્યવસ્થા કરવાની રહેશે.

ગેજિયા વતી,


સુધીરભાઇ વિચારે
(સેક્રેટરી)